

B.Com. Semester - 3 (NEP-2020) Examination

OCT/NOV-2025

Business Accounting-3 (Major-6)

Time: 2:00 Hours

Marks:50

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ કિશીવ લિ.નું તા. 31-03-2025ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

(૧૦)

જવાબદારીઓ	રકમ (રૂ.)	મિલકતો	રકમ (રૂ.)
ઈક્વિટી શેરમૂડી દરેક રૂ. 10નો એક એવા 2,00,000 ઈ. શેર્સ પૂર્ણ ભરપાઈ	20,00,000	જમીન અને મકાન	15,00,000
10%ની પ્રેફ. શેરમૂડી 60,000 પ્રેફ. શેર દરેક રૂ. 10નો પૂર્ણ ભરપાઈ	6,00,000	યંત્રો	10,00,000
સામાન્ય અનામત	4,00,000	ચાલુ મિલકતો	9,50,000
નફા-નુકસાન ખાતું	3,00,000	પ્રાથમિક ખર્ચા	50,000
લેણદારો	2,00,000		
	35,00,000		35,00,000

વધારાની માહિતી:

- (1) જમીન અને મકાન, યંત્રો તથા ચાલુ મિલકતોની હાલની બજારકિંમત અનુક્રમે રૂ. 20,00,000, રૂ. 8,00,000 અને રૂ. 9,00,000 છે.
- (2) આ કંપનીના જેવો જ ધંધો કરતી અને 16% ડિવિડન્ડ આપતી કંપનીના ઈક્વિટી શેરનો બજાર ભાવ તેની વસુલ રકમ કરતા બે ગણો છે.
- (3) 50% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો છેલ્લા ત્રણ વર્ષનો નફો અને ઉપયોગમાં લેવાનો યોગ્ય ભાર નીચે મુજબ છે.

વર્ષ	નફો (રૂ.)	ભાર
2022-2023	5,00,000	1
2023-2024	5,75,000	2
2024-2025	6,50,000	3

ઉપરની માહિતી પરથી ધિક નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધો.

અથવા

પ્રશ્ન.૧ પાર્શ્વ લિ.ની નીચેની માહિતી પરથી અધિક નફાની રીતે પાંચ વર્ષની ખરીદીના ધોરણે પાઘડીની ગણતરી કરો.

25,000 ઈક. શેર દરેક રૂ. 100નો	25,00,000
10%ના 5,000 પ્રેફ. શેર દરેક રૂ. 100નો	5,00,000
સામાન્ય અનામત	60,000
ન. નુ. ખાતું (જમા)	70,000
લેણદારો	1,00,000
દેવીફૂડી	80,000
પ્રોવિડન્ટ ફંડ	50,000
છેલ્લા ચાર વર્ષનો કુલ નફો (50% લેખે આવકવેરો ગણ્યા પહેલા)	64,00,000
રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર	7%
એવા દંધામાં રોકાયેલી મૂડી પર જોખમનો દર	3%

કંપનીની કુલ મિલકતો આ પ્રમાણે છે.

કાયમી મિલકતો કુલ મિલકતોના	75%
ચાલુ મિલકતો કુલ મિલકતોના	20%
અવાસ્તવિક મિલકતો કુલ મિલકતોના	05%

પ્રશ્ન.૨ તા. 31-03-2025ના રોજનું શિવાંશ કંપની લિ.નું પાકું સરવૈયું નીચે મુજબ છે.

(૧૦)

મૂડી-દેવાં	રકમ(રૂ.)	મિલકતો	રકમ (રૂ.)
ઈક. શેર દરેક રૂ. 100ના પૂરા ભરપાઈ	50,00,000	જમીન અને મકાન	20,00,000
10%ની પ્રેફ. શેરમૂડી દરેક રૂ. 100ના શેરમાં	10,00,000	પ્લાન્ટ અને મશીનરી	30,00,000
સામાન્ય અનામત	4,00,000	ફર્નિચર	2,00,000
નફા-નુકસાન ખાતું	2,00,000	સ્ટોક	10,00,000
15%ના ડિબેન્ચર	5,00,000	દેવાદારો	8,00,000
લેણદારો	7,00,000	લેણીફૂંડિઓ	5,00,000
દેવીફૂંડિ	2,00,000	રોકડ અને બેંક સિલક	4,00,000
		પ્રાથમિક ખર્ચા	1,00,000
	80,00,000		80,00,000

વધારાની માહિતી:

- (1) જમીન અને મકાનની કિંમતમાં 25% અને સ્ટોકની કિંમતમાં 20% વધારો કરવો.
- (2) પ્લાન્ટ અને મશીનરીની બજાર કિંમત રૂ. 28,00,000 છે.
- (3) કંપનીનો સરેરાશ વાર્ષિક નફો(50% લેખે કરવેરા પહેલાનો) રૂ. 32,00,000 છે.
- (4) આ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર વળતરનો દર 15% છે.
- (5) કંપનીની પાઘડીની કિંમત તેના અધિક નફાની બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે.

ઉપરની વિગતો પરથી ઇક્વિટી શેરની આંતરીક કિંમત શોધો.

અથવા

પ્રશ્ન.૨ પ્રશીલ લિ.નું તા. 31-03-2025ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

જવાબદારીઓ	રકમ (રૂ.)	મિલકતો	રકમ (રૂ.)
ઈક. શેરમૂડી : રૂ. 100નો તેવા 4,000 ઈક. શેર	4,00,000	જમીન અને મકાન	2,50,000
સામાન્ય અનામત	1,00,000	પ્લાન્ટ અને મશીનરી	1,50,000
નફા-નુકસાન ખાતું	50,000	રોકાણો: પડતર કિંમત	
		(બજાર કિંમત રૂ.75,000)	90,000
લેણદારો	90,000	સ્ટોક	75,000
કરવેરાની જોગવાઈ	40,000	દેવાદારો	1,00,000
પ્રોવિડંડ ફંડ	35,000	બેંક સિલક	35,000
		પ્રાથમિક ખર્ચા	15,000
	7,15,000		7,15,000

પ્લાન્ટ અને મશીનરી તથા જમીન અને મકાનની કિંમત અનુક્રમે રૂ. 1,10,000 અને 2,75,000 આંકવામાં આવી. કુલ દેવાદારોમાંથી રૂ. 5,000 ડુબેલા છે.

પાઘડીની કિંમત તેના અધિક નફાની ચાર વર્ષની ખરીદીના આધારે ગણવાની છે.

છેલ્લા ચાર વર્ષનો નફો અનુક્રમે વર્ષ માર્ચ 2022 થી માર્ચ 2025 સુધીનો રૂ. 80,000, રૂ. 70,000, રૂ. 60,000 અને રૂ. 95,000 હતો.

ધંધાનો પ્રકાર ધ્યાનમાં લેતા રોકાયેલી મૂડી પર વાજબી વળતર દર 12.5% ગણવાનું છે.

ઉપરોક્ત વિગતોનાં આધારે ઇક્વિટી શેરની આંતરીક કિંમત શોધો.

તા. 01-01-2024ના રોજથી અશોક બ્રધર્સનો ચાલુ ધંધો ખરીદી લેવા તા. 01-05-2024ના રોજ શ્રી પ્રકાશ લિ.ની સ્થાપના કરવામાં આવી. કંપનીના પ્રથમ હિસાબો તા. 31-10-2024ના રોજ તૈયાર કરવામાં આવ્યા. નીચેની માહિતી પરથી નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો-નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો.

વિગત	રકમ(રૂ.)	વિગત	રકમ(રૂ.)
વેચાણ પર કમિશન(2%)	10,000	વેચનારને ચૂકવેલ વ્યાજ	3,000
શેર ટ્રાન્સફર ફી	500	ઘાલખાદ્ય	2,000
મળેલ ભાડું	5,000	પગાર	10,000
જાહેરાત ખર્ચ(દર મહિને રૂ. 100)	1,000	પ્રાથમિક ખર્ચાં	3,000
સામાન્ય ખર્ચ	1,500	ઘાલખાદ્ય અનામત	1,000
ઘસારો	9,000	ડિરેક્ટર ફી	4,000
ડિબેન્ચર વટાવ	2,500	ઓડિટ ફી	1,200
સેલ્સમેનના ભથ્થાં	1,000	ભાડું	2,600
		વેચાણ પર કાચા નફાનો દર 30% છે.	

વધારાની માહિતી:

- (1) રૂ. 1,000 ઘાલખાદ્ય નોંધણી પહેલાની છે.
- (2) સ્થાપના પહેલાનું વેચાણ રૂ. 1,00,000 છે.
- (3) વેચનારને ખરીદ કિંમત તા. 01-07-2024ના રોજ ચૂકવાય છે.
- (4) ભાડું તા. 01-06-2024 સુધી માસિક રૂ. 200 લેખે અને ત્યારબાદ માસિક રૂ. 400 લેખે ચૂકવેલ છે. તા. 01-10-2024 થી મકાન ખરીદી લીધેલ છે.
- (5) ઓડિટ ફી તથા પ્રાથમિક ખર્ચ સ્થાપના પછીના ખર્ચ તરીકે ગણવાના છે.

અથવા

ભોલા બ્રધર્સની ચાલુ પેઢીનો ધંધો તા. 01-01-2024 થી ખરીદી લેવા માટે ગોલ્ડી લિ.ની તા. 01-05-2024ના રોજ સ્થાપના કરવામાં આવી. તા. 31-12-2024ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વેપાર ખાતું અને નફા-નુકસાન ખાતું નીચે મુજબ છે.

વેપાર ખાતું

વિગત	રકમ(રૂ.)	વિગત	રકમ(રૂ.)
ખરીદી તા. 30-04-2024 સુધી (સ્ટોકનો હવાલો નાખ્યા પછી)	2,70,000	વેચાણ (તા. 30-04-2024 સુધીનું)	3,20,000
ખરીદી (તા. 01-05-2024 થી તા. 31-12-2024 સુધી)	3,80,000	વેચાણ (તા. 01-05-2024 થી તા. 31-12-2024 સુધી)	4,80,000
કાચો નફો	1,50,000		
	8,00,000		8,00,000

નફા-નુકસાન ખાતું

વિગત	રકમ (રૂ.)	વિગત	રકમ (રૂ.)
કરવેરા ભાડું	12,000	કાચો નફો	1,50,000
ડિરેક્ટર ફી	4,000	રોકાણોનું વ્યાજ	900
પગાર	24,000	શેરફેરબદલી ફી	200
વેચનારને વ્યાજ	18,000		
ઘાલખાદ્ય	3,500		
ઘસારો	6,000		
જાહેરાત	5,000		
જાવકમાલ ગાડાભાડું	100		
તાર-ટપાલ ખર્ચ	600		
રોકાણ વેચાણની ખોટ	500		

માંડિ વાળેલ પ્રાથમિક ખર્ચ	5,000		
ડિબેન્ટર વ્યાજ	6,000		
ઓડિટ ફી	1,200		
ઘાલખાદ્ય અનામત	4,000		
છપામણી સ્ટેશનરી	1,200		
ચોખ્ખો નફો	60,000		
	1,51,100		1,51,100

અન્ય માહિતી:

(1) રોકાણો તા. 30-06-2024ના રોજ વેચવામાં આવ્યા હતા.

(2) ખરીદ કિંમત તા. 01-09-2024ના રોજ ચૂકવવામાં આવી હતી.

(3) ઘાલખાદ્ય અનામત નોંધણી પછીના દેવાદારોને લગતી છે.

ઉપરની વિગતો પરથી નોંધણી પહેલાનો અને નોંધણી પછીનો નફો-નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો.

પ્રશ્ન.૪ લક્ષ્મીબેન ચાવડા એક નાના ખેડૂત છે. તા. 31-03-2025ના વર્ષથી તેમની ખેતીને લગતી આવક ખર્ચની તથા અન્ય (૧૦) વિગતો નીચે મુજબ આપે છે.

શરૂઆતનો સ્ટોક (રૂ.) : ખાતર 12,000, ડાંગર 8,000, જંતુનાશક દવા 10,000

ખરીદી (રૂ.) : ખાતર 40,000, ડિઝલ 12,000, બિયારણ 22,500

મજૂરી ચૂકવી (રૂ.) : કાચમી કામદારો 20,000, છુટક કામદારો 16,000

રૂ.

પશુધન પાછળનો ખર્ચ	48,000
સાધન રીપેરીંગ ખર્ચ	10,000
જમીન મહેસુલ	5,000
પાકવીમાનું પ્રીમીયમ	2,000
ખેતીની મોટરનું વિજળી બીલ	20,000
ખેતીની મિલકતનો ઘસારો	7,000
પોતાની મિલકતનો ઘસારો	2,000
મશીન અને સાધનોની ખરીદી	1,00,000
ભાવેશ પાસેથી ઉછીના	20,000
કાચમી કામદારોને ચૂકવવાની બાકી મજૂરી	4,000
વિજયની લોન	1,50,000

વધારાની માહિતી:

(1) ઘઉંનું ઉત્પાદન 15,000 કિ.ગ્રા. થયેલું જેની પડતર કિ.ગ્રા. દીઠ રૂ. 18 ગણવાની છે.

12,300 કિ.ગ્રા. ઘઉંનું કિ.ગ્રા. દીઠ રૂ. 25 લેખે વેચાણ કરેલ છે.

600 કિ.ગ્રા. ઘઉં ઘરવપરાશ માટે લીધા હતા.

600 કિ.ગ્રા. ઘઉં ચોરાઈ ગયા હતા.

500 કિ.ગ્રા. ઘઉં ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધા હતા.

(2) બાજરીનું ઉત્પાદન 6,000 કિ.ગ્રા. થયેલું જેની પડતર કિ.ગ્રા. દીઠ રૂ. 15 ગણવાની છે.

4,500 કિ.ગ્રા. બાજરીનું રૂ. 20 લેખે વેચાણ કરેલ છે.

400 કિ.ગ્રા. બાજરી ઘરવપરાશ માટે લીધી હતી.

500 કિ.ગ્રા. બાજરી ધર્માદામાં આપી હતી.

500 કિ.ગ્રા. બાજરી મજૂરોને મજૂરીના બદલામાં આપી હતી.

(3) દુધનું ઉત્પાદન 5,000 લીટર થયેલ લીટર દીઠ રૂ. 30 લેખે વેચ્યું હતું.

(4) ડાંગરનું કુલ ઉત્પાદન રૂ. 40,000માં વેચેલ છે.

(5) ઘી 100 કિ.ગ્રા. રૂ. 500નું કિલો લેખે વેચેલ છે.

કૃષિ ખાતું બનાવો.

પ્રશ્ન.૪ નીચે આપેલી વિગતો પરથી તા. 31-03-2025ના રોજ પૂરા થતા વર્ષનું દિવ્યેશ હોલાનું કૃષિ ખાતું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
શરૂનો સ્ટોક:		જમીન મહેસુલ	4,000
ખાતર	40,000	વીમા પ્રીમીયમ:	
બિયારણ	15,000	પાક	1,000
ઉભોપાક	10,000	ઢોર-ઢાંખર	2,000
ઢોર-ઢાંખર	60,000		
ખરીદી:		વેચાણ:	
ખાતર	60,000	ઘાસ	40,000
બિયારણ	16,000	દુધ	60,000
જંતુનાશક દવા	30,000	ચોખા	1,50,000
ઢોર-ઢાંખર	20,000	ઘઉં	2,00,000
વાડ કરવાનો ખર્ચ	30,000		
મજૂરી	50,000		
10%ની સહકારી મંડળીની લોન(તા. 01-10-2024)	2,00,000		

વધારાની માહિતી:

- (1) આખર સ્ટોક(31-03-2025) ખાતર રૂ. 20,000, બિયારણ રૂ. 6,000 અને ઢોર-ઢાંખર રૂ. 70,000.
- (2) રૂ. 10,000ની કિંમતનું ઘાસ(રજકો) પોતાના ઢોર-ઢાંખરને ખવડાવવા ઉગાડેલ છે.
- (3) અંગત વપરાશ માટે લીધેલ અનાજ: ઘઉં રૂ. 8,000 અને ચોખા રૂ. 4,000.
- (4) ધર્માદામાં આપેલ અનાજ રૂ. 10,000
- (5) વાડ કરવાનું ખર્ચ દસ વર્ષમાં માંડી વાળવાનો છે.

પ્રશ્ન.૫ ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે)

(૧૦)

- (1) પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો ચર્ચો.
- (2) ઇક્વિટી શેરની આંતરીક કિંમત સમજાવો.
- (3) નોંધણી પહેલાનો નફો અને નોંધણી પછીના નફા વચ્ચેનો તફાવત આપો.
- (4) કૃષિના હિસાબો પર નોંધ લખો.

English Version

Que.1 The following is the B/S of Krishiv Ltd. as on 31-03-2025.

(10)

Liabilities	Amt. (Rs.)	Assets	Amt. (Rs.)
Equity share capital: 2,00,000 Equity shares each of Rs. 10 fully paid up	20,00,000	Land and Building	15,00,000
60,000, 10% Pref. shares each of Rs. 10 fully paid	6,00,000	Machinery	10,00,000
General Reserve	4,00,000	Current Assets	9,50,000
P and L A/c	3,00,000	Preliminary Expenses	50,000
Creditors	2,00,000		
	35,00,000		35,00,000

Additional Information:

- (1) The present market value of Land and Building, Machinery and Current Assets are Rs. 20,00,000, Rs. 8,00,000 and Rs. 9,00,000 respectively.
- (2) The market price of the Equity shares of the company, doing similar business and giving dividend at 16% I twice of the paid up value.
- (3) The profits of the company before providing tax at 50% for the last three years and appropriate weights to be used are as under:

Year	Profit (Rs.)	Weight
2022-2023	5,00,000	1
2023-2024	5,75,000	2
2024-2025	6,50,000	3

From the above particulars find out the value of Goodwill of the company at three years purchase of its super profits.

OR

Que.1 Following information of Parthiv Ltd. find out Goodwill by purchase of five years excess profit method.

25,000 Equity shares each of Rs. 100	25,00,000
10%, 5,000 Pref. shares each of Rs. 100	5,00,000
General Reserve	60,000
P and L A/c (Credit)	70,000
Creditors	1,00,000
Bills payable	80,000
Provident Fund	50,000
Total Profit of four years (before 50% tax)	64,00,000
Expected rate of return on capital	7%
Risk rate in such business	3%

Total Assets of company are as under:

Fixed Assets of total Assets	75%
Current Assets of Total Assets	20%
Fictitious Assets of Total Assets	05%

Que.2 The following is the Balance sheet of Shivansh Ltd. as on 31-03-2025.

(10)

Liabilities	Amt. (Rs.)	Assets	Amt. (Rs.)
Equity shares of : Rs. 100 each fully paid up	50,00,000	Land and Building	20,00,000
10% Pref. shares of Rs. 100 each fully paid up	10,00,000	Plant and Machinery	30,00,000
General Reserve	4,00,000	Furniture	2,00,000
Profit and Loss A/c	2,00,000	Stock	10,00,000
15% Debentures	5,00,000	Debtors	8,00,000
Creditors	7,00,000	Bills Receivable	5,00,000
Bill Payable	2,00,000	Cash and Bank	4,00,000
		Preliminary Expenses	1,00,000
	80,00,000		80,00,000

Additional Information:

- (1) Market price of Land and Building is 25% high and that of stock is 20% high.
- (2) Market price of plant and machinery is 28,00,000.
- (3) The company average annual profit(before deducting tax at 50%) is 32,00,000
- (4) The expected rate of return on capital employed in this type of Business is considered to be 15%
- (5) The value of Goodwill of the company has been ascertained at two year's purchase of super profit.

From the above particular ascertain the Intrinsic Value of Equity share of the company.

OR

Que.2 The Balance sheet of Prashil Ltd. as on 31-03-2025 is given as under.

Liabilities	Amt. (Rs.)	Assets	Amt. (Rs.)
4,000 Equity shares of Rs. 100 each	4,00,000	Land and Building	2,50,000
General Reserve	1,00,000	Plant and Machinery	1,50,000
Profit and Loss A/c	50,000	Investments at cost (market price Rs. 75,000)	90,000
Creditors	90,000	Stock	75,000
Provision for taxation	40,000	Debtors	1,00,000
Provident Fund	35,000	Bank Balance	35,000
		Preliminary Expense	15,000
	7,15,000		7,15,000

Plant and Machinery and Land and Building are valued at Rs. 1,10,000 and Rs. 2,75,000 respectively.

The Total Debtors Rs. 5,000 are bad. Goodwill is to be taken at 4 years purchase of super profit.

The profits of the company for the last four years were as follow:

2022: Rs. 80,000, 2023: Rs. 70,000, 2024: Rs. 60,000, 2025: Rs.95,000

The normal return on capital employed applicable to particular type of company is 12.5%.

From the above particulars ascertain the Intrinsic value of Equity share of the company.

Que.3 Shri Prakash Ltd. was incorporated on 01-05-2024 to purchase existing business of Ashok Brothers with effect from 01-01-2024 first final Accounts of the company were prepared on 31-10-2024. Prepare statements showing profit-loss of periods prior to and after incorporation from the information given below: (10)

Particulars	Amt.(Rs.)	Particulars	Amt.(Rs.)
Commission on sales(2%)	10,000	Interest paid to seller	3,000
Share transfer fee	500	Bad-Debts	2,000
Rent Received	5,000	Salary	10,000
Advertisement Expenses (Rs.100 every month)	1,000	Preliminary Expenses	3,000
General Expenses	1,500	Bad-debts Reserve	1,000

Depreciation	9,000	Director fee	4,000
Debenture Discount	2,500	Audit fee	1,200
Allowances of salesman	1,000	Rent	2,600
		Rate of Gross profit on sales is 30%	

Additional Information:

- (1) Bad-debts of Rs.1,000 is for period prior to incorporation.
- (2) Sales prior to incorporation is Rs.1,00,000.
- (3) Seller is paid purchase price on 01-07-2024.
- (4) Rent is paid Rs. 200 per month till 01-06-2024 and Rs. 400 per month thereafter. Building has been purchased w.e.f. 01-10-2024.
- (5) Audit fee and preliminary Expenses are to be considered after incorporation period.

OR

Que.3 Goldy Ltd. Was registered on 01-05-2024 to take over the business of Bhola brothers from 01-01-2024. The Accounts of the company for the year ended 31-12-2024 disclosed the following particulars. From the following information given to you, you are required to calculate the profit earned by the company in pre and post incorporation period.

Trading Account

Particulars	Amt. (Rs.)	Particulars	Amt. (Rs.)
To purchase upto 30-04-2024 (after stock adjustment)	2,70,000	Sales (up to 30-04-2024)	3,20,000
To purchase (from 01-05-2024 to 31-12-2024)	3,80,000	Sales (from 01-05-2024 to 31-12-2024)	4,80,000
To gross profit	1,50,000		
	8,00,000		8,00,000

Profit and Loss Account

Particulars	Amt. (Rs.)	Particulars	Amt. (Rs.)
Rent and Taxes	12,000	Gross profit	1,50,000
Director's fee	4,000	Share transfer fee	200
Salary	24,000	Interest on Investment	900
Interest on vendor	18,000		
Bad-debts	3,500		
Depreciation	6,000		
Advertisement	5,000		
Carriage outward	100		
Postage	600		
Loss on sales of investment	500		
Preliminary Expenses written off	5,000		
Debenture interest	6,000		
Audit fee	1,200		
Bad-debts Reserve	4,000		
Printing-Stationary	1,200		
Net profit	60,000		
	1,51,100		1,51,100

Additional information:

- (1) Investments were sold on 30-06-2024.
- (2) Purchase price was paid on 01-09-2024.
- (3) Bad-debts is related to debtors of post incorporation period.

Que.4 Laxmiben Chavda is a small farmer. He gives you incomes and expenditures figure and other information (10) for the farm for the year ended Dt. 31-03-2025.

Opening stock : (Rs.) Fertilizer 12,000, Paddy 8,000, Pesticided 10,000.
Purchases : (Rs.) Fertilizers 40,000, Diesel 12,000, seeds 22,500.
Wages paid : (Rs.) Parmanent workers 20,000, Casual workers 16,000

Rs.

Expense of live stock 48,000
Tool repairing 10,000
Land revenue 5,000
Insurance premium for crop 2,000
Farm's electrical motor bill 20,000
Depreciation on farm assets 7,000
Depreciation on own assets 2,000
Machine and tools purchased 1,00,000

Barrowed from Bhavesha	20,000
Outstanding wages for prmanent workers	4,000
Vijay's loan	1,50,000

Other information:

- (1) Production of wheat was 15,000Kg. which cost be considered Rs. 18 per Kg. of this production.
Wheat 12,300 Kg. were sold at Rs. 25 per Kg.
Wheat of 600 Kg. were taken for personal use.
Wheat of 600 Kg. were stolen away.
Wheat of 500 Kg. were used for feeding his cattle.
- (2) Production of Millet was 6,000 Kg. which cost to be considered Rs. 15 per Kg. out of this production.
Millet of 4,500 Kg. were sold at Rs. 20 per Kg.
Millet of 400 Kg. were taken for personal use.
Millet of 500 Kg. were given as donation.
Millet of 500 Kg. were given to workers in lieu of wages.
- (3) Production of Milk was 5,000 liters; it was sold out at Rs. 30 per liter.
- (4) Paddy production was sold out of Rs. 40,000.
- (5) Ghee was sold 100 Kg. at Rs. 500 per Kg.

Prepare Farm Account.

OR

- Que.4 From the follwing information prepare the farm account of Mr. Divyesh Dhola for the year ended 31-03-2025.

Particulars	Rs.	Particulars	Rs.
Opening Stock:		Land revenue	4,000
Fertilizer	40,000	Insurance Premium:	
Seeds	15,000	Crop	1,000
Standing crops	10,000	Cattle	2,000
Cattle	60,000		
Purchases:		Sales:	
Fertilizer	60,000	Grass	40,000
Seeds	16,000	Milk	60,000
Pesticide	30,000	Rice	1,50,000
Cattle	20,000	Wheat	2,00,000
Cost of fence	30,000		
Labour wages	50,000		
10% Co-op. Loan (Dt. 01-10-2024)	2,00,000		

Additional information:

- (1) Closing stock 31-03-2025 fertilizers Rs. 20,000, seeds Rs. 6,000 and cattle Rs. 70,000.
- (2) Cultivated grass of Rs. 10,000 for feeding own cattle
- (3) Take wheat of Rs. 8,000 and rice Rs. 4,000 for personal use.
- (4) Gave a donation corn Rs. 10,000.
- (5) The cost of fence to be abolished within ten years.

- Que.5 Write a short note. (Any two)

- (1) Discuss the factor affecting to valuation of Goodwill
- (2) Explain intrinsic value of Equity share
- (3) Differentiate between profit prior incorporation and after incorporation.
- (4) Write a note on Farm accounting.

(10)